



બ્રેમ્પટન સ્થાનિક ધોરણે બહોળા પ્રમાણમાં અનુભવી રહ્યું છે પૂરની સ્થિતિ

રહેવાસીઓ સલામત રહે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (17 ફેબ્રુઆરી 2022) – આખા શહેરમાં બહોળા પ્રમાણમાં બ્રેમ્પટન પૂરની સ્થિતિ અનુભવી રહ્યું છે. પૂર આવે ત્યારે રહેવાસીઓ સલામત રહે તેની સ્મૃતિ અપાવીએ છીએ.

આ સમયે સિટી વાકેફ છે કે નીચે આલ વિસ્તારો સ્થાનિક પૂરથી અસરગ્રસ્ત છે:

- વિન્સ્ટન ચર્ચીલ બૂલવર્ડ ખાતે વાનલેસ રોડ
- હેરિટેજ રોડ પર બોવેઈર ડ્રાઈવથી વાનલેસ ડ્રાઈવ
- હોલસ્ટોન રોડ ખાતેનો કેડિટવ્યુ રોડ
- સ્ટીલ્સ અવેન્યુ ખાતેનો કેડિટવ્યુ રોડ
- ચર્ચવિલ રોડ ખાતેનો કેડિટવ્યુ રોડ
- ક્લેરન્સ સ્ટ્રીટ બ્રિજ
- પીલ વિલેજમાં કિવાનિસ બ્રિજ

શક્ય હોય તો રહેવાસીઓએ આ વિસ્તારોમાં જવું ટાળવું અને સુરક્ષા સાવચેતીઓને અનુસરવી:

- સ્થિર પાણીમાં ઘરની અંદર રહેવા વિદ્યુત ઉપકરણો અને ભૂગર્ભના અથવા નીચે રહેલી પાવરની લાઈન્સને કારણે વિદ્યુત ચાર્જની હાજરી હોઈ શકે છે. નીચે પડેલી પાવર લાઈન્સ અને ભરાયેલા સ્થિર પાણીથી પોતાની જાતને, બાળકો અને પાળેલા પશુને દૂર રાખશો.
- પૂરના પાણી ઝડપથી આવી શકે છે અને તેમા ડૂબી જવાનું જોખમ છે. પોતાની સલામતી રાખવી અને પૂરના પાણીમાંથી ચાલવું કે વાહન ચલાવવા નહીં.
- મકાનના માળખા અસરગ્રસ્ત થઈ શકે અને અસુરક્ષિત બની શકે. સંભવિતપણે મકાનના પાયા કે માળખામાં કોઈપણ માળખાકીય નુકસાનના ચિહ્નો દેખાય તો પોતાના ઘરમાંથી દૂર થઈ જવું જેમાં સામેલ છે પોર્ચની છત અને લટકતી છતો.
- પૂરના પાણીથી ઘણી વખત માર્ગો અને વોકવેઝનું ધોવાણ થતું હોય છે. માર્ગો નબળા પડ્યા હોય તેમ બને અને કારના વજનથી ભાંગી પડી શકે છે. પૂરના પાણીમાં ચાલવું અથવા વાહન ચલાવવા નહીં.
- પૂરના પાણીમાં ગટરના પાણી (જેમાં બેક્ટેરિયા, વાયરસ કે પરજીવીઓ સમાયેલા હોઈ શકે), રસાયણો અને કાચના ટુકડા જેવો કચરો હોઈ શકે. નીચાણવાળા વિસ્તારોને ટાળો. પૂરના પાણીથી પોતાની જાતને, બાળકો અને પાળેલા પશુને દૂર રાખશો.



- पूर विस्तारमां प्रवेश करवो नर्ली सिवायके उचित व्यक्तिगत सुरक्षात्मक साधनो अने पडेरवेश पडेर्यो लोय.

जो रडेवासीओ अतरानो सामनो करे तो तेमाणे तात्कालिक 9-1-1 पर झोन करवो. नगरपालिकांना रस्ता पर स्थानिक पूर, अवरोधित स्टोर्म सिवर ग्रेट अथवा बेजमेन्टमां पाणी भरया लोय त्यारे 311 पर झोन करवो.

अद्यतन अपडेट्स माटे रडेवासीओअे Twitter पर [@BEMOPrepared](https://twitter.com/BEMOPrepared) ने झेलो करवुं अने पूर सलामतीनी माळिती माटे www.brampton.ca नी मुलाकात लेवी.

-30-

मिडिया संपर्क (MEDIA CONTACT):

सीटी ओइ ब्रम्पटन मल्टिकल्चरल मिडिया

multiculturalmedia@brampton.ca